

તાત્કાલિક પ્રકાશન માટે

હ્યુરોન્ટેરિયો લાઈટ રેઈલ ટ્રાન્ઝિટ મેટ્રોલિંક્સના ફેઝ વનની (પહેલા તબક્કાની) ઘોષણા પર સીટી ઓફ બ્રામ્પટનનું નિવેદન

બ્રામ્પટન, ઓન્ટેરિયો (માર્ચ 21, 2019) – આજે [મેટ્રોલિંક્સ દ્વારા આપવામાં આવેલા નિવેદન](#) પછી, સીટી ઓફ બ્રામ્પટન હ્યુરોન્ટેરિયો લાઈટ રેઈલ ટ્રાન્ઝિટ (LRT) પ્રોજેક્ટ આગળ વધવાની વાતથી રોમાંચિત છે. આ પ્રોજેક્ટમાં હ્યુરોન્ટેરિયો સ્ટ્રીટને ગતિશીલ જાહેર જનતાલક્ષી કોરિડોરમાં પરિવર્તિત કરવાની સંભાવના રહેલી છે, જે આગામી 30 ઉપરાંત વર્ષોમાં સમુદાયોને સાંકળીને અપેક્ષિત વૃદ્ધિને અનુકૂળ બનાવશે.

આપણાં શહેરવાસીઓ સમજે છે કે મેટ્રોલિંક્સે ઘોષિત કરેલા ફેરફારો એકંદરે પ્રોજેક્ટને સમયસર અને કાર્યક્ષમ રીતે અમલમાં મૂકવા જરૂરી છે. આપણું શહેર સુધારેલા કરારમાં બ્રામ્પટનમાં સંભવિત વિસ્તરણ સહિત, ભાવિ ફેરફારો સાથે અનુકૂળ હોય એ જોગવાઈઓ જોઈને રાજ થયું છે.

આ ફેરફારો હજુ પણ સ્ટીલ્સ એવન્યુની ઉત્તરેથી બ્રામ્પટન GO સ્ટેશન સુધી ભાવિ LRT વિસ્તરણ થવા દેવાની છૂટ આપે છે, જે આગળ અભ્યાસો અને મંજૂરીઓને અધીન રહેશે.

સીટી ઓફ બ્રામ્પટન પોર્ટ કેડિટ GO થી બ્રામ્પટન ગેટવે ટર્મિનલ સુધી હ્યુરોન્ટેરિયો LRT નાં અમલીકરણ પર મેટ્રોલિંક્સ અને સીટી ઓફ મિસિસાગા સાથે મળીને કામ કરી રહ્યું છે. હ્યુરોન્ટેરિયો LRT પ્રાદેશિક પરિવહન નેટવર્કનો અતૂટ ભાગ બની રહેશે અને બ્રામ્પટન અને ગ્રેટર ટોરોન્ટો અને હેમિલ્ટન વિસ્તારમાં રહેવાસીઓ અને ધંધાઓને ઝડપી, ભરોસાપાત્ર, અનુકૂળ અને એકીકૃત પારગમન (ટ્રાન્ઝિટ) પૂરું પાડશે.

અવતરણ (ક્વોટ):

“કાર્યક્ષમ ટ્રાન્ઝિટ આપણાં રહેવાસીઓ દ્વારા વ્યાખ્યાંકિત શહેરની મુખ્ય અગ્રતાઓ પૈકી એક છે. આ પ્રોજેક્ટને આગળ વધવાની મંજૂરી મળવાથી અમે ખુશ છીએ. અમે ડાઉનટાઉન બ્રામ્પટન GO સુધી આગળ વધી શકતા ટનલ વિકલ્પ સહિત, ફેઝ 2 માટે તમામ શક્યતાઓ જોવાનું ચાલુ રાખીએ છીએ ત્યારે, ખાસ કરીને બ્રામ્પટનમાં સંભવિત વિસ્તરણ માટે કરાર સુધારામાં જોગવાઈઓ જોઈને ખુશ છીએ.”

- મેયર પેટ્રિક બ્રાઉન (Patrick Brown)

-30-

બ્રમ્પટન વિશાળ આયોજનો વિષે વિચારે છે. અમે તીક્ષ્ણ ફોક્સ ધરાવતા ભવિષ્ય માટે તૈયાર સંગઠન છીએ. અમે જાણીએ છીએ કે આપણા સમુદાયની વૃદ્ધિ, યુવાની અને વૈવિધ્ય આપણને અલગ ઓળખ પ્રદાન કરે છે. અમે કેનેડાના ઈનોવેશન સુપર કોરિડોર ખાતે સ્થિત છીએ જ્યાં રોકાણોને પ્રોત્સાહિત કરીએ છીએ અને વૈશ્વિક સ્તરે અમારી સફળતામાં વૃદ્ધિ કરી રહ્યા છીએ. અમે બનાવી રહ્યા છીએ એવા ગતિશીલ શહેરી કેન્દ્રો જે તકોનો તણખો ચાંપે છે અને અહીં કામ કરતા લોકોમાં ગૌરવની લાગણીનો સંચાર કરે છે. અમે બ્રમ્પટનને આગળ ધપાવી રહ્યા છીએ જેથી તે એક જોડાણ ધરાવતું શહેર બને જે પ્રવર્તનાત્મક, વ્યાપક અને સાહસિક હોય. અમને [Twitter](#), [Facebook](#), અને [Instagram](#) પર અનુસરો. અહીં વધુ જાણકારી મેળવો www.brampton.ca.

मिडिया संपर्क:

मोनिका दुग्गल

कोऑर्डिनेटर, मिडिया अेन्ड कम्युनिटी अेंगेजमेन्ट

प्यूब्लिक संवाड

सीटी ओफ् ब्राम्पटन

905-874-3426 | Monika.Duggal@brampton.ca